

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લીમીટેડ, વર્તુળ કચેરી, જામનગર

લોક દરબાર તારીખ : ૦૮.૦૪.૨૦૧૬ શુક્રવાર	સ્થળ : શ્રી ભલારાદાદા ટ્રસ્ટની જગ્યા, મુ.લાલપુર	સમય : ૧૦:૩૦ કલાકે	તાલુકો : લાલપુર
---------------------------------------	---	-------------------	-----------------

તા.૦૮.૦૪.૨૦૧૬ ના રોજ લાલપુર મૂકામે સરકારશ્રી દ્વારા માનનિય કેબીનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયાની હાજરીમાં યોજાયેલ “લોક સંવાદ સેતુ - લોક દરબાર” અંતર્ગત રજુ થયેલ પ્રશ્ન/રજુઆતની વિગતો:

(પ્રગતિ અહેવાલ તા.૦૯.૦૫.૨૦૧૬)

ક્રમ	પ્રશ્ન નંબર	અરજદારશ્રી નું નામ	પ્રશ્નની ટુંકી વિગત	અમલીકરણ અધિકારી / ખાતાના વડાશ્રીનો પ્રશ્ન નિકાલ અંગેનો જવાબ	રીમાર્ક્સ
૦૧	૦૪	હિરીબેન ડાયાભાઈ મકવાણા, જય ભીમવાસ જૂના રેલ્વે સ્ટેશન સામે, જામનગર.	લાલપુર પી.જી.વી.સી.એલ. છેલ્લા નવ વર્ષ થયા ઘર વપરાશ માટે વિજ જોડાણ આપતી નથી તે બાબતે	સદર અરજદાર દ્વારા વાડી વિસ્તારમાં ઘરવપરાશ ના વિજજોડાણ માટે અરજી સાથે જરૂરી દસ્તાવેજ ૭/૧૨, ૮-અ તથા ૬-નંબર નું હકપત્રક જોડી અત્રેની કચેરીમાં અરજી કરેલ નથી. જેથી અરજદારને ઘરવપરાશનું વિજજોડાણ આપેલ નથી.	નિકાલ
૦૨	૩૦	મગનભાઈ રામજીભાઈ સોજીત્રા, ગામ : મોટી વેરાવળ	વિજ ધારકો પાસે થી મીટરનું ભાડું વસુલ કરવામાં આવતું હોવા છતાં સીલ તોડવા તથા સીલ લગાવવા ની રકમ વસુલ કરવા બાબત.	વિજધારકોને ત્યાં લગાડવામાં આવેલા વિજમીટરોમાં કોઈપણ કારણોસર ખામી સર્જાય છે ત્યારે તે કામગીરી કરવા માટે જુના સીલ ફુર કરીને નવા સીલ લગાડવામાં આવે છે, જેના ચાર્જ પેટે ગુજરાત વિજ નિયમન પંચ અને કંપનીના પ્રવર્તમાન નિયમ અનુસાર રી-સીલીંગ ચાર્જ વસુલવામાં આવે છે.	નિકાલ
૦૩	૩૩	જેન્તીલાલ ગોવિંદભાઈ ઘાઘરા મેઇન રોડ, લાલપુર.	ખાતેદાર ખેડૂત ની એક જ ખાતા નંબર વાળી ખેતીની જમીનમાં બીજું વિજ કનેક્શન ના આપવા બાબત.	પરિપત્ર નંબર GUVNL-TECH-AG-2189, DT.24.10.2013 મુજબ કંપનીના પ્રવર્તમાન નિયમ અનુસાર એક જ સર્વે નંબરમાં બીજું વીજજોડાણ આપી શકાય નહીં	નિતિ વિષયક

૦૪	૫૧	સરપંચ શ્રી નાની રાકુદડ ગ્રામ પંચાયત. ગામ: નાની રાકુદડ	નાની રાકુદડ ગામે વીજલાઇનમાં લો - વોલ્ટેજ નાં પ્રશ્ન બાબત.	અરજદાર તરફ થી મળેલ ફરિયાદ ના અનુસંધાને નાની રાકુદડ ગામનાં ટ્રાન્સફોર્મરનો લોડ ચેક કરતાં ટ્રાન્સફોર્મરમાં બેલેન્સ લોડ માલૂમ નાં પડતાં તા.૦૪/૦૪/૨૦૧૬ નાં રોજ ટ્રાન્સફોર્મરનો લોડ બેલેન્સ કરીને લો- વોલ્ટેજની ફરિયાદનું નિરાકરણ કરેલ છે	નિકાલ
૦૫	૫૨	સરપંચ શ્રી ખાયડી ગ્રામ પંચાયત. ગામ: ખાયડી	ખાયડી ગામ નાં વાડીવિસ્તાર સાતપડામાં જ્યોતિગ્રામ યોજનામાં ટ્રાન્સફોર્મર મૂકવા બાબત.	સદર વિસ્તારમાં કંપનીના પ્રવર્તમાન નિયમાનુસાર ખેતીવાડી વિસ્તારમાં ખેતીવાડી ફીડરમાંથી ઘરવપરાશ હેતુનાં વિજજોડાણો આપવામાં આવે છે. આ ખેતીવાડી ફીડરોમાં દિવસમાં આઠ કલાક થ્રી-ફેઝ અને બાકીના ૧૬ કલાક સિંગલ-ફેઝ વિજપુરવહો કે જેનો ઘરવપરાશમાં ઉપયોગ થઇ શકે તે હેતુથી આપવામાં આવે છે.	નિકાલ
૦૬	૭૯	સરપંચ શ્રી નવી પીપર ગ્રામ પંચાયત. ગામ: નવી પીપર	ખેતીવાડી વિસ્તારમાં વીજવાયરો બદલવા બાબત.	અરજદાર તરફ થી મળેલ અરજી નાં અનુસંધાને જણાવવા નું છે કે ૧૧ કેવી પીપર ખેતીવાડી ફિડરમાં ખીરસરા ગામ પછીની સ્વિચથી પથુભાની વાડીની સ્વિચ સુધીનાં ૧૦ ગાળાનાં જર્જરીત વાયરો બદલાવેલ છે અને બાકીના ૨૦ ગાળાના વાયરો તા.૦૯.૦૫.૨૦૧૬ ના રોજ બદલાવીને કામગીરી પુર્ણ કરેલ છે.	નિકાલ